

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી:-

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ શાક માર્કેટમાં લાંબા સમયથી લીઝ ભાડું નહીં ભરતા 272 થડા હોલ્ડરનાં થડાની ફાળવણી રદ/ખાલસા કરવા મ્યુનિ. કમિશનરશ્રી બંધાનિધિ પાનીનો હુકમ

ખાલસા કરેલ થડા/વખાર જાહેર હરરાજીથી બીજા લાભાર્થીઓને ફાળવવા કાર્યવહી કરવામાં આવશે

તારીખ: ૧૫-૦૬-૨૦૧૯

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ શાક માર્કેટમાં વ્યવસ્થા અને સ્વચ્છતા જળવાઈ રહેતેવા હેતુથી શાક માર્કેટની અંદર અલગ-અલગ હોલ્ડરોને થડા ફાળવવામાં આવેલ છે, આ થડાનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માસિક લીઝ ભાડું રૂપિયા ૫૦૦/- વસુલ કરવામાં આવે છે, અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાક માર્કેટમાં લાંબા સમયથી લીઝ ભાડું નહીં ભરતા 272 થડા હોલ્ડરનાં થડાની ફાળવણી રદ કરી થડા ખાલસા કરવામાં આવેલ છે, ખાલસા કરેલ થડા/વખાર જાહેર હરરાજીથી બીજા લાભાર્થીઓને ફાળવવામાં પણ આવશે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી બંધાનિધિ પાનીએ જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ કહેલું કે, શાક માર્કેટમાં થડા હોલ્ડરોને એક લીઝ એગ્રીમેન્ટ કરી આપવામાં આવે છે, જેમાં શરતોમાં દર્શાવેલું હોય છે કે માસિક લીઝ ચાર્જ જે માસનું હોય તે માસની દર મહિનાની તારીખ: ૧ થી ૫ સુધીમાં પૂરેપૂરું ભરી આપવાનું રહેશે. જો તેમાં સમયસર લીઝ ભાડું નહિ ચૂકવો તો દર માસ દીઠ પેનલ્ટી અથવા વખતો-વખત રાજકોટ મહાનગરપાલિકા નિયત કરે તે પ્રમાણે નોટીસ ફી ભરવાની રહેશે. પરંતુ શાક માર્કેટના કેટલાક થડા હોલ્ડરો દ્વારા લીઝ ડીડમાં દર્શાવ્યા પ્રમાણે કબુલાત કરેલ હોવા છતાં પણ લાંબા સમયથી લીઝ ચાર્જ ભરપાઈ કરેલ નથી. આ હોલ્ડરોને વારંવાર નોટીસ બજાવી બાકી લીઝ ચાર્જ ભરપાઈ કરી જવા જણાવેલ છે, આમ છતાં થડા હોલ્ડરો દ્વારા નોટીસમાં દર્શાવેલ ચડત માસિક લીઝ ચાર્જ નહિ ભરતા અને રાજકોટ મહાનગરપાલિકાની નોટીસનો જવાબ નહિ કરતા થડા ખાલસા કરવામાં આવ્યા હતા.

આ થડા હોલ્ડરોએ છેલ્લા ૧૦ માસથી ૭ વર્ષ સુધી થડાનું લીઝ ચાર્જ ભરેલ નથી અને કાયદા અને લીઝ ડીડની શરતોનું પાલન કરેલ નથી. આ બાબત જાહેર પ્રજાહિતમાં બિલકુલ

ચલાવી શકશે નહિ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક ઉમદા હેતુથી થડા ફાળવવામાં આવ્યા હતા તેમ છતાં થડા હોલ્ડરો દ્વારા તેનો ભંગ કરતા થડા હોલ્ડરના નામેથી રદ/ખાલસા કરી જે-તે થડો રાજકોટ મહાનગરપાલિકામાં પરત લેવામાં આવ્યા છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી બંધાનિધિ પાનીએ જણાવ્યું હતું.

શહેરમાં આવેલ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની શાક માર્કેટમાંથી જે થડાને ખાલસા કરવામાં આવ્યા હતા તેમાં, (1). જ્યુબિલી ભાગ 1 – 35, (2). જ્યુબિલી ભાગ 2 – 22, (3). જ્યુબિલી નાળિયેર માર્કેટ – 18, (4). ભોજા ભગત માર્કેટ – 35, (5). લાખાજીરાજ માર્કેટ – 118, (6). ગોવિંદબાગ માર્કેટ – 33, (7). હુડકોં માર્કેટ – 11 આમ કુલ થડા/વખાર - 272 ને રદ/ખાલસા કરવામાં આવ્યા હતા. જે ખાલસા કરેલ થડાની બાકી રહેતી રકમ ૫૦.૨૩ લાખ હતી. ખાલસા કરેલ થડા/વખાર જાહેર હરરાજીથી બીજા લાભાર્થીઓને ફાળવવા કાર્યવહી કરવામાં આવશે , તેમ પણ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

(જન સંપર્ક અધિકારી)
રાજકોટ મહાનગરપાલિકા